

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટે તા. ૦૬/૧૦/૨૦૧૮ ના રોજ જાહેરાત ક્રમાંક: ૧૪૬/૨૦૧૮૧૯ થી ૧૪૯/૨૦૧૮૧૯ અને તા. ૦૭/૦૩/૨૦૧૯ ના રોજ જાહેરાત ક્રમાંક: ૧૬૭/૨૦૧૮૧૯ થી ૧૮૦/૨૦૧૮૧૯ પ્રસિધ્ધ કરી ઓન-લાઇન અરજીપત્રકો મેળવવામાં આવેલ હતા. ઉક્ત અરજીપત્રકોની પ્રાથમિક ચકાસણી (એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ ? અને **General** કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ ?) ને અંતે નીચે દર્શાવેલ સંવર્ગોમાં પ્રાથમિક રીતે લાયક ગણવાપાત્ર ઉમેદવારોની જાહેરાતમાં વર્ણવ્યા મુજબની પ્રથમ તબક્કાની **MCQ - OMR** પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી ગાંધીનગર ખાતેના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર યોજવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે. અનિવાર્ય કારણોસર આ કાર્યક્રમમાં મંડળ ફેરફાર કરી શકશે.

અ.નં.	જાહેરાત ક્રમાંક	સંવર્ગોનું નામ	પરીક્ષાની સંભવિત તારીખ
૧	૧૬૯/૨૦૧૮૧૯	સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (રેફ્રીજરેશન એન્ડ એર કંડીશનીંગ ગ્રુપ)	૦૭/૦૭/૨૦૧૯ સવારે: ૧૧-૦૦ થી ૧૩-૦૦ કલાકે
૨	૧૭૧/૨૦૧૮૧૯	સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગ્રુપ)	૦૭/૦૭/૨૦૧૯ બપોરે: ૧૫-૦૦ થી ૧૭-૦૦ કલાકે
૩	૧૭૨/૨૦૧૮૧૯	સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઇન્સ્ટ્રુમેન્ટેશન ગ્રુપ)	૦૮/૦૭/૨૦૧૯ બપોરે: ૧૫-૦૦ થી ૧૭-૦૦ કલાકે
૪	૧૭૫/૨૦૧૮૧૯	સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (કેમિકલ ગ્રુપ)	૦૯/૦૭/૨૦૧૯ બપોરે: ૧૫-૦૦ થી ૧૭-૦૦ કલાકે
૫	૧૭૯/૨૦૧૮૧૯	સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ગારમેન્ટ્સ ગ્રુપ)	૧૦/૦૭/૨૦૧૯ બપોરે: ૧૫-૦૦ થી ૧૭-૦૦ કલાકે
૬	૧૭૮/૨૦૧૮૧૯	સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (બ્યુટી કલ્ચર એન્ડ હેર ડ્રેસીસ ગ્રુપ)	૧૧/૦૭/૨૦૧૯ બપોરે: ૧૫-૦૦ થી ૧૭-૦૦ કલાકે
૭	૧૪૭/૨૦૧૮૧૯	આસીસ્ટન્ટ ક્યુરેટર	૧૨/૦૭/૨૦૧૯ બપોરે: ૧૫-૦૦ થી ૧૭-૦૦ કલાકે

૮	૧૭૪/૨૦૧૮૧૯	સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (ઓટોમોબાઇલ ગ્રુપ)	૧૪/૦૭/૨૦૧૯ સવારે: ૧૧-૦૦ થી ૧૩-૦૦ કલાકે
૯	૧૭૩/૨૦૧૮૧૯	સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર (સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ)	૧૪/૦૭/૨૦૧૯ બપોરે: ૧૫-૦૦ થી ૧૭-૦૦ કલાકે

સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ તેમજ રદ થયેલ અરજીપત્રકોની વિગતો (પરીક્ષા ફી ન ભરવાના કારણસર અને એક કરતાં વધુ અરજી કરેલ હોય તેવા કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક ગ્રાહ્ય રાખીને બાકીના અરજીપત્રકો ડુપ્લીકેશનના કારણસર રદ ગણવામાં આવેલ છે તેવા અરજીપત્રકોની) પરીક્ષાની તારીખના ૧૦ દિવસ પહેલાં મંડળની વેબસાઇટ <https://gsssb.gujarat.gov.in> પર મુકવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

સ્થળ:- ગાંધીનગર
તા. ૧૧/૦૬/૨૦૧૯

સચિવ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,
ગાંધીનગર